

PART PLAN SHOWING
BLOCK NO :- 244
VILLAGE:- VISALPUR
TALUKA:- DASKROI
DISTRICT: AHMEDABAD



1 cm = 80.00 mt

LEGEND



-  GENERAL AGRICULTURAL ZONE-A1
-  RESIDENTIAL AFFORDABLE HOUSING ZONE-RAH
-  Existing Road
-  Village Boundary
-  Proposed Road
-  AMC Boundary
-  TPS Boundary

Part Plan of Sanctioned Development plan (Second Revised) of AUDA Under Govt. Notification no . GH/V/207 of 2014/DVP-112013-4777-L Dated-20/12/2014 U/S -17(1)(c) of the G.T.P.& U.D. Act-1976




This part plan is certified for the **BLOCK NO :- 244**

NOTE :- This part plan cannot be used for making any entry in revenue records and can not be considered as Development Permission or Permission for Addition/Alteration.

Prep. By: 
 Chd. By: 
 M. D. man: 
 Date: 07-10-2020
 Receipt No: 3698

TRUE COPY


Assistant Town Planner
Ahmedabad Urban Development Authority
Ahmedabad.

PART PLAN OF DRAFT
TOWN PLANNING SCHEME -NO.-402/A (VISALPUR)

FINAL PLOT NO: 40

ORIGINAL PLOT -




SCALE:1C.M.=20.0M.



LEGEND

== O.P BOUNDARY
== F.P BOUNDARY



This part plan is certified for the F.P NO: 40

SANCTIONED UNDER GOVT. NOTIFICATION NO:
GH/V/55 OF 2018/TPS-112017-719-L. DATE: 01-05-2018.

NOTE:- Final plots boundary and allotment of final plot as subject to variation.
This part plan cannot be used for making any entry in revenue records
and can not be considered As Development Permission
or Permission for Addition/Alteration.

Prep. By

Chd. By:

H. D' man:

TRUE COPY

Assistant Town Planner
Ahmedabad Urban Development Authority
Ahmedabad.



અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ

સરદાર વલ્લભભાઈ પટેલ ભવન, આશ્રમ રોડ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪.
ફોન નં.: ૨૭૫૪૫૦૫૧, ૨૭૫૪૫૦૫૨, ૨૭૫૪૫૦૫૪



ઑડાની વેબ સાઈટ : www.auda.org.in

- ઑડાની વિકાસ યોજના.
- માળખાકીય સુવિધાઓ. (INFRASTRUCTION)
- સામાજિક સેવાઓની યોજનાઓ.

હવે વિવિધ માહિતી ઉપલબ્ધ છે, - જેવી કે...

- નગર રચના યોજનાઓ. (ટી.પી.સ્કીમ)
- પર્યાવરણલક્ષી યોજનાઓ
- અન્ય પ્રોજેક્ટ

અરજી નંબર -

પહોંચ નંબર ૨૫૮૫

પ્રતિ શ્રી, અમ. જી. ડાહી

અમદાવાદ.

ઝોનીંગ સર્ટીફિકેટ

તા.: ૦૮-૦૮-૨૦૨૦

વિષય : વિકાસ યોજના ૨૦૨૧ ના ઝોનીંગ સર્ટીફિકેટ અંગે.

સંદર્ભ : આપશ્રીની તા. ૦૪.૦૮-૨૦૨૦ ની અરજી અન્યથે

ઉપરોક્ત વિષયે મોજે વિમલપુર તાલુકો દસ્ક્રોઈ બ્લોક નં./સર્વે નં. ૨૪૪

ની જમીન ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ ની કલમ ૧૭ (૧) (ક) હેઠળ તા. ૨૦-૧૨-૨૦૧૪ ના રોજ રાજ્ય સરકાર શ્રી એ મંજૂર કરેલ દ્વિતીય પુનરાવર્તિત વિકાસ નકશાની દરખાસ્ત મુજબ સદરહુ જમીનમાંથી

૬૦.૦૦ ચોરસ

ના રોડની કપાત થાય છે. બાકીનો ભાગ

જનરલ એગ્રીકલ્ચરલ-A1 અને અપવા

અપવા રેસીડેન્સીયલ એસીડેન્સીયલ હાઉસીંગ-RAH

ઝોનમાં આવે છે.

૧. સદરહુ જમીન ટી.પી. સ્કીમ નં ૪૦૨/૨૫ (વિમલપુર) ફાઈટ મંજૂર

તથા ના વિસ્તારમાં આવતી હોવાથી

તેને ટી.પી. સ્કીમ હેઠળ અન્ય દરખાસ્તો - જોગવાઈઓ ફેરફાર ને બંધનકર્તા રહેશે.

૨. દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજનાની દરખાસ્તો સરકાર શ્રી ને આધીન ફેરફારને પાત્ર રહેશે.

નોંધ : “આ ફક્ત ઝોનીંગ સર્ટીફિકેટ છે
બાંધકામની પરવાનગી નથી”

CHD BY; ૧૪
HD MAN; ૧૪



A.M.
મદદનીશ નગર નિયોજક
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ
અમદાવાદ

